

Extra No. 178



The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXIII] TUESDAY, SEPTEMBER 27, 2022 / ASVINA 5, 1944

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨

તારીખ: ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા સન ૨૦૨૨ના ગુજરાત અધિનિયમ ક્રમાંક: ૮નો ગુજરાતી અનુવાદ આથી સર્વે લોકોની જાણ સારૂ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

GUJARAT ACT NO. 8 OF 2022.

THE GUJARAT GOODS AND SERVICES TAX (AMENDMENT) ACT, 2022.

ગુજરાત વિધાનમંડળના નીચેના અધિનિયમને રાજ્યપાલે સન ૨૦૨૨ ના સપ્ટેમ્બર મહિનાની ૨૬મી તારીખે અનુમતિ આપી હોવાથી, તે આથી સર્વે લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

કે.એમ.લાલા,

ગુજરાત સરકારના સચિવ,

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ.

GUJARAT ACT NO. 8 OF 2022.

AN ACT

further to amend the Gujarat Goods and Services Tax Act, 2017.

સન ૨૦૨૨ નો ગુજરાત અધિનિયમ ક્રમાંક: ૮.

(રાજ્યપાલની અનુમતિ મળ્યા પછી, સન ૨૦૨૨ ના સપ્ટેમ્બર મહિનાની ૨૭મી તારીખે “ગુજરાત સરકારી રાજપત્ર”માં (અંગ્રેજીમાં) પ્રથમ પ્રસિદ્ધ કરેલો.)

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ વધુ સુધારવા બાબત અધિનિયમ.

આથી, ભારતના ગણરાજ્યના તોત્તેરમા વર્ષમાં નીચેનો અધિનિયમ કરવામાં આવે છે:-

૧. (૧) આ અધિનિયમ ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) અધિનિયમ, ૨૦૨૨ કહેવાશે. (૨) તે, રાજ્ય સરકાર, રાજપત્રમાં જાહેરનામાથી, નક્કી કરે તેવી તારીખે અમલમાં આવશે: પરંતુ આ અધિનિયમની જુદી જુદી જોગવાઈઓ માટે જુદી જુદી તારીખો નક્કી કરી શકાશે.

ટૂંકી સંજ્ઞા અને આરંભ.

સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૧૬નો સુધારો.

૨. ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (જેનો આમાં હવે પછી, “મુખ્ય અધિનિયમ” તરીકે ઉલ્લેખ કર્યો છે તે)માં, કલમ ૧૬માં,-

સન ૨૦૧૭નો ગુજરાતનો ૨૫-મો.

- (ક) પેટા-કલમ (૨)માં,-

- (૧) ખંડ (ખ)પછી, નીચેનો ખંડ દાખલ કરવો:-

“(ખક) કલમ ૩૮ હેઠળ આવી રજિસ્ટર થયેલી વ્યક્તિને જાણ કરવામાં આવેલ, સદરહુ પુરવઠાના સંબંધમાં ઈનપુટ વેરા શાખની વિગતો, મર્યાદિત કરવામાં આવી ન હોય;”;

- (૨) ખંડ (ગ)માં, “અથવા કલમ ૪૩ક” એ શબ્દો, આંકડા અને અક્ષર કમી કરવા;

- (ખ) પેટા-કલમ (૪)માં, “સપ્ટેમ્બર મહિના માટે કલમ ૩૮ હેઠળ પત્રક પૂરું પાડવાની અથવા સંબંધિત વાર્ષિક પત્રક પૂરું પાડવાની નિયત તારીખ,” એ શબ્દો અને આંકડાને બદલે, “નવેમ્બર મહિનાની ત્રીસમી તારીખ પછી અથવા સંબંધિત વાર્ષિક પત્રક પૂરું પાડ્યા પછી” એ શબ્દો મૂકવા.

૩. મુખ્ય અધિનિયમમાં, કલમ ૨૮માં, પેટા-કલમ (૨)માં,-

- (ક) ખંડ (ખ)માં, “લાગલાગટ ત્રણ વેરા મુદત” એ શબ્દોને બદલે, “સદરહુ પત્રક ૨જૂ કરવાની નિયત તારીખથી ત્રણ મહિનાથી વધુ નાણાકીય વર્ષ” એ શબ્દો મૂકવા;

સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૨૮નો સુધારો.

(ખ) ખંડ (ગ)માં, “ છ મહિનાની સળંગ મુદત” એ શબ્દોને બદલે, “ઠરાવવામાં આવે તેવી સળંગ વેરા મુદત” એ શબ્દો મૂકવા.

સન ૨૦૧૭ના
ગુજરાતના
૨૫-મા અધિનિયમની
કલમ ૩૪નો
સુધારો.

૪. મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૪માં, પેટા-કલમ (૨)માં, “સપ્ટેમ્બર મહિનાથી” એ શબ્દોને બદલે, “નવેમ્બર મહિનાની ત્રીસમી તારીખથી” એ શબ્દો મૂકવા.

સન ૨૦૧૭ના
ગુજરાતના
૨૫-મા
અધિનિયમની
કલમ ૩૭નો સુધારો.

૫. મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૭માં, -

(ક) પેટા-કલમ (૧)માં,-

(૧) “ઠરાવવામાં આવે તેવા નમૂનામાં અને તેવી રીતે” એ શબ્દોને બદલે, “ઠરાવવામાં આવે તેવી શરતો અને તેવા નિયંત્રણોને અધીન રહીને અને તેવા નમૂનામાં અને તેવી રીતે” એ શબ્દો મૂકવા;

(૨) “ઠરાવવામાં આવે તેટલા સમયમાં અને તેવી રીતે, સદરહુ પુરવઠાના લેનારને જણાવવી જોઈશે” એ શબ્દોને બદલે, “આવી શરતો અને નિયંત્રણોને અધીન રહીને, ઠરાવવામાં આવે તેટલા સમયમાં અને તેવી રીતે, સદરહુ પુરવઠાના લેનારને જણાવવી જોઈશે” એ શબ્દો મૂકવા;

(૩) પ્રથમ પરંતુક કમી કરવો;

(૪) બીજા પરંતુકમાં, “વધુમાં”, એ શબ્દને બદલે, “પરંતુ” એ શબ્દ મૂકવો;

(૫) ત્રીજા પરંતુકમાં, “વળી” એ શબ્દને બદલે, “વધુમાં” એ શબ્દ મૂકવો;

(ખ) પેટા-કલમ (૨) કમી કરવી;

(ગ) પેટા-કલમ (૩) માં,-

(૧) “અને કલમ ૪૨ અથવા કલમ ૪૩ હેઠળ અસંગત રહી હોય તેવી” એ શબ્દો અને આંકડા કમી કરવા;

(૨) પ્રથમ પરંતુકમાં, “સપ્ટેમ્બર મહિના માટે કલમ ૩૮ હેઠળ પત્રક રજૂ કર્યા” એ શબ્દો અને આંકડાને બદલે, “સપ્ટેમ્બર મહિનાની ત્રીસમી તારીખ” એ શબ્દો મૂકવા;

(ઘ) પેટા-કલમ (૩) પછી, નીચેની પેટા-કલમ દાખલ કરવી:-

“(૪) રજિસ્ટર થયેલી વ્યક્તિએ, અગાઉની વેરા મુદતો પૈકીની કોઈ મુદત માટે જાવક પુરવઠાની વિગતો રજૂ કરી ન હોય, તો તેને, વેરા મુદત માટે કલમ (૧) હેઠળ જાવક પુરવઠાની વિગતો રજૂ કરવાની પરવાનગી આપવી જોઈશે નહિ:

પરંતુ સરકાર, કાઉન્સિલની ભલામણોને આધારે, જાહેરનામાથી, તેમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી શરતો અને તેવા નિયંત્રણોને અધીન રહીને, તેણે એક અથવા વધુ અગાઉની વેરા મુદતો માટે જાવક પુરવઠાની વિગતો રજૂ કરી ન હોય, તો પણ, રજિસ્ટર થયેલી વ્યક્તિ અથવા રજિસ્ટર થયેલી વ્યક્તિઓના વર્ગને, પેટા-કલમ (૧) હેઠળ જાવક પુરવઠાની વિગતો રજૂ કરવાની પરવાનગી આપી શકશે.”.

સન ૨૦૧૭ના ગુજરાતના
૨૫-મા અધિનિયમની
કલમ ૩૮નો સુધારો.

૬. મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૮ને બદલે, નીચેની કલમ મૂકવી:

જાવક અને ઈનપુટ
વેરા શાખની
વિગતોની
જાણ કરવા બાબત.

“૩૮. (૧) કલમ ૩૭ની પેટા-કલમ (૧) હેઠળ રજિસ્ટર થયેલી વ્યક્તિઓએ રજૂ કરેલ જાવક પુરવઠા અને ઠરાવવામાં આવે તેવા અન્ય પુરવઠાની વિગતો, અને આવા પુરવઠાના મેળવનારને, ઠરાવવામાં આવે તેવા નમૂનામાં અને તેવી રીતે, તેટલા સમયની અંદર, અને આવી શરતો અને નિયંત્રણોને અધીન રહીને, ઇલેક્ટ્રોનિક રીતે, ઈનપુટ વેરા શાખની વિગતો ધરાવતું ઓટો-જનરેટેડ પત્રક, ઉપલબ્ધ કરાવવું જોઈશે.

- (ર) પેટા-કલમ (૧) હેઠળ ઓટો-જનરેટેડ પત્રકમાં -
- (ક) જેના સંબંધમાં મેળવનારને ઈનપુટ વેરા શાખ ઉપલબ્ધ હોય તેવી આવક પુરવઠાની વિગતોનો; અને
- (ખ) (૧) ઠરાવવામાં આવે તેવું રજિસ્ટ્રેશન લીધાની આવી મુદતની અંદર કોઈ રજિસ્ટર થયેલી વ્યક્તિ દ્વારા; અથવા
- (૨) વેરાની ચૂકવણીમાં કસૂર કરી હોય અને ઠરાવવામાં આવે તેવી મુદત માટે આવું કસૂર કરવાનું ચાલુ રાખ્યું હોય તેવી કોઈ રજિસ્ટર થયેલી વ્યક્તિ દ્વારા; અથવા
- (૩) જેના દ્વારા ઠરાવવામાં આવે તેવી મુદત દરમિયાન, સદરહુ પેટા-કલમ હેઠળ તેણે રજૂ કરેલા જાવક પુરવઠાના પત્રક અનુસાર ચૂકવવાપાત્ર આઉટપુટ વેરો, ઠરાવવામાં આવે તેવી મર્યાદાથી સદરહુ મુદત દરમિયાન તેણે ચૂકવેલા આઉટપુટ વેરા કરતા વધુ હોય તેવી કોઈ રજિસ્ટર થયેલી વ્યક્તિ દ્વારા; અથવા
- (૪) ઠરાવવામાં આવે તેવી મુદત દરમિયાન, જેણે ઈનપુટ વેરા શાખની રકમ મેળવી હોય તે રકમ (શાખ), ઠરાવવામાં આવે તેવી મર્યાદાથી ખંડ (ક) અનુસાર, તેના દ્વારા મેળવી શકાય તેવી શાખ (રકમ) કરતા વધુ હોય તેવી કોઈ રજિસ્ટર થયેલી વ્યક્તિ દ્વારા; અથવા
- (૫) ઠરાવવામાં આવે તેવી શરતો અને તેવા નિયંત્રણોને અધીન રહીને, કલમ ૪૮ની પેટા-કલમ (૧૨)ની જોગવાઈઓ અનુસાર તેની વેરા જવાબદારી અદા કરવામાં કસૂર કરી હોય તેવી કોઈ રજિસ્ટર થયેલી વ્યક્તિ દ્વારા; અથવા
- (૬) ઠરાવવામાં આવે તેવી વ્યક્તિઓના અન્ય વર્ગ દ્વારા,
- કલમ ૩૭ની પેટા-કલમ (૧) હેઠળ રજૂ કરવામાં આવેલા સદરહુ પુરવઠાની વિગતોના કારણે, જેના સંબંધમાં મેળવનાર દ્વારા આવી શાખ, પછી ભલે તે સંપૂર્ણતઃ અથવા અંશતઃ હોય તે મેળવી શકાય તેમ ન હોય તેવી પુરવઠાની વિગતોનો સમાવેશ થશે.”.

૭. મુખ્ય અધિનિયમમાં, કલમ ૩૮માં,-

- (ક) પેટા-કલમ (૫)માં, “વીસ” એ શબ્દને બદલે, “તેર” એ શબ્દ મૂકવો:
- (ખ) પેટા-કલમ (૭)માં, પ્રથમ પરંતુકને બદલે, નીચેનો પરંતુક મૂકવો:-

“પરંતુ પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ પત્રક રજૂ કરતી હોય તેવી દરેક રજિસ્ટર થયેલી વ્યક્તિએ, ઠરાવવામાં આવે તેવા નમૂનામાં અને તેવી રીતે અને તેટલી મુદતની અંદર સરકારને,-

- (ક) માલ અથવા સેવા અથવા તે બંનેના આવક અને જાવક પુરવઠાને ધ્યાનમાં લઈને ચૂકવવાની થતી વેરા જેટલી રકમ, મેળવેલી ઈનપુટ વેરા શાખ, ચૂકવવાપાત્ર વેરો અને મહિના દરમિયાન એવી અન્ય વિગતો; અથવા
- (ખ) ખંડ (ક)માં ઉલ્લેખિત રકમને બદલે, ઠરાવવામાં આવે તેવી રીતે અને તેવી શરતો અને તેવા નિયંત્રણોને અધીન રહીને, નક્કી કરેલી રકમ ચૂકવવી જોઈશે.”;
- (ગ) પેટા-કલમ (૯)માં, -

સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા
અધિનિયમની કલમ
૩૮નો સુધારો.

- (૧) “કલમો ૩૭ અને ૩૮ની જોગવાઈઓને અધીન રહીને” એ શબ્દો, આંકડા અને અક્ષર કમી કરવા અને “શોધી કાઢે, તો” એ શબ્દો અને અક્ષરને બદલે, “શોધી કાઢે, ત્યારે” એ શબ્દો મૂકવા;
- (૨) પરંતુકમાં, “સપ્ટેમ્બર મહિના અથવા તેના બીજા ત્રિમાસ માટેનું પત્રક રજૂ કરવા માટેની નિયત તારીખ” એ શબ્દોને બદલે, “નવેમ્બર મહિનાની ત્રીસમી તારીખ” એ શબ્દો મૂકવા;
- (૬) પેટા-કલમ (૧૦)માંના પરિચ્છેદને બદલે, નીચેનો પરિચ્છેદ અને પરંતુક મૂકવો:-

“રજિસ્ટર થયેલી વ્યક્તિએ, અગાઉની વેરા મુદતો પૈકીની કોઈ મુદત માટેનું પત્રક અથવા સદરહુ વેરા મુદત માટે કલમ ૩૭ની કલમ (૧) હેઠળ જાવક પુરવઠાની વિગતો રજૂ કરી ન હોય, તો તેને, વેરા મુદત માટે પત્રક રજૂ કરવાની પરવાનગી આપવી જોઈશે નહિ:

પરંતુ સરકાર, કાઉન્સિલની ભલામણોને આધારે, જાહેરનામાથી, તેમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી શરતો અને તેવા નિયંત્રણોને અધીન રહીને, રજિસ્ટર થયેલી વ્યક્તિ અથવા રજિસ્ટર થયેલી વ્યક્તિઓના વર્ગને, તેણે એક અથવા તેથી વધારે અગાઉની વેરા મુદતો માટે પત્રકો રજૂ કર્યા ન હોય અથવા સદરહુ વેરા મુદત માટે કલમ ૩૭ની કલમ (૧) હેઠળ જાવક પુરવઠાની વિગતો રજૂ કરી ન હોય તેમ છતાં, પત્રક રજૂ કરવાની પરવાનગી આપી શકશે.”.

સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા
અધિનિયમની કલમ
૪૧ને બદલવા
બાબત.

૮. મુખ્ય અધિનિયમમાં, કલમ ૪૧ને બદલે, નીચેની કલમ મૂકવી:-

ઈનપુટ વેરા
શાખ મેળવવા
બાબત.

૪૧. (૧) દરેક રજિસ્ટર થયેલી વ્યક્તિ, ઠરાવવામાં આવે તેવી શરતો અને તેવા નિયંત્રણોને અધીન રહીને, પોતાના પત્રકમાં, સ્વ-આકારણી કર્યા પ્રમાણે, પાત્ર ઈનપુટ વેરા શાખ મેળવવા હકદાર થશે અને આવી રકમ, તેની ઇલેક્ટ્રોનિક શાખ ખાતાવહી (કેડિટ લેજર)માં જમા કરવી જોઈશે.

(૨) જેના પર પુરવઠાકાર દ્વારા ચૂકવવાપાત્ર વેરો ચૂકવવામાં આવ્યો ન હોય તેવા માલ અથવા સેવા અથવા તે બંનેના એવા પુરવઠાના સંબંધમાં, પેટા-કલમ (૧) હેઠળ રજિસ્ટર થયેલી વ્યક્તિ દ્વારા મેળવેલી ઈનપુટ વેરા શાખ, ઠરાવવામાં આવે તેવી રીતે સદરહુ વ્યક્તિ દ્વારા લાગુ પડતા વ્યાજ સાથે ઉલટાવવી જોઈશે:

પરંતુ ઉપર્યુક્ત પુરવઠાના સંબંધમાં, સદરહુ પુરવઠાકાર ચૂકવવાપાત્ર વેરાની ચુકવણી કરે, ત્યારે સદરહુ રજિસ્ટર થયેલી વ્યક્તિ, ઠરાવવામાં આવે તેવી રીતે તેના દ્વારા ઉલટાવવામાં આવેલી શાખની રકમ ફરીથી મેળવી શકશે.”.

સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા
અધિનિયમની
કલમો ૪૨, ૪૩
અને ૪૩ ક-ને
કમી કરવા બાબત.

૯. મુખ્ય અધિનિયમમાં, કલમો ૪૨, ૪૩ અને ૪૩ક કમી કરવી.

સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા
અધિનિયમની કલમ
૪૭નો સુધારો.

૧૦. મુખ્ય અધિનિયમમાં, કલમ ૪૭માં, પેટા-કલમ (૧)માં,-

- (ક) “અથવા આવક” એ શબ્દો કમી કરવા;
- (ખ) “અથવા કલમ ૩૮” એ શબ્દો અને આંકડા કમી કરવા;
- (ગ) “કલમ ૩૮ અથવા કલમ ૪૫” એ શબ્દો અને આંકડા પછી, “અથવા કલમ ૫૨” એ શબ્દો અને આંકડા દાખલ કરવા;

સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા
અધિનિયમની
કલમ ૪૮નો
સુધારો.

૧૧. મુખ્ય અધિનિયમમાં, કલમ ૪૮માં, પેટા-કલમ (૨)માં, “કલમ ૩૭ હેઠળ જાવક પુરવઠાની વિગતો, કલમ ૩૮ હેઠળ આવક પુરવઠા” એ શબ્દો અને આંકડાને બદલે, “કલમ ૩૭ હેઠળ જાવક પુરવઠાની વિગતો” એ શબ્દો અને આંકડા મૂકવા.

૧૨. મુખ્ય અધિનિયમમાં, કલમ ૪૮માં,-

- (ક) પેટા-કલમ (૨)માં, “ અથવા કલમ ૪૩ક” એ શબ્દો, આંકડા અને અક્ષર કમી કરવા;
- (ખ) પેટા-કલમ (૪)માં, “તેવી શરતોને અધીન રહીને” એ શબ્દોને બદલે, “ તેવી શરતો અને તેવા નિયંત્રણોને અધીન રહીને” એ શબ્દો મૂકવા;
- (ગ) પેટા-કલમ (૧૧) પછી, નીચેની પેટા-કલમ ઉમેરવી:-

સન ૨૦૧૭નો ૧૩મો. “(૧૨) આ અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, સરકાર, કાઉન્સિલની ભલામણોને આધારે, તેવી શરતો અને તેવા નિયંત્રણોને અધીન રહીને, આ અધિનિયમ અથવા સંકલિત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ હેઠળ આઉટપુર વેરા જવાબદારીનું એવું વધુમાં વધુ પ્રમાણ નિર્દિષ્ટ કરી શકશે, જે ઠરાવવામાં આવે તેવી રજિસ્ટર થયેલી વ્યક્તિ અથવા રજિસ્ટર થયેલી વ્યક્તિઓના વર્ગ દ્વારા ઈલેક્ટ્રોનિક શાખ ખાતાવહી મારફત અદા કરી શકાશે.”.

સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૫૦નો સુધારો.

૧૩. મુખ્ય અધિનિયમમાં, કલમ ૫૦માં, પેટા-કલમ (૩)ને બદલે, નીચેની પેટા-કલમ મૂકવી અને તે સન ૨૦૧૭ના જુલાઈ મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ મૂકી હોવાનું ગણાશે:-

“(૩) ઈનપુટ વેરા શાખ ખોટી રીતે મેળવી હોય અને ઉપયોગ કરી હોય, ત્યારે રજિસ્ટર થયેલી વ્યક્તિએ, કાઉન્સિલની ભલામણોને આધારે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેટલા ચોવીસ ટકાથી વધુ ન હોય તેટલા દરે, ખોટી રીતે મેળવેલી અને ઉપયોગ કરેલી આવી ઈનપુટ વેરા શાખ પર વ્યાજ ચૂકવવું જોઈશે અને ઠરાવવામાં આવે તેવી રીતે વ્યાજની ગણતરી કરવી જોઈશે.”.

સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૫૨-નો સુધારો.

૧૪. મુખ્ય અધિનિયમમાં, કલમ ૫૨-માં, પેટા-કલમ (૬)માં, પરંતુકમાં, “સપ્ટેમ્બર મહિના માટે પત્રક રજૂ કરવા માટેની નિયત તારીખ” એ શબ્દોને બદલે, “નવેમ્બર મહિનાની ત્રીસમી તારીખ” એ શબ્દો મૂકવા.

સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૫૪નો સુધારો.

૧૫. મુખ્ય અધિનિયમમાં, કલમ ૫૪માં,-

- (ક) પેટા-કલમ (૧)માં, પરંતુકમાં, “તેવી રીતે કલમ ૩૯ હેઠળ રજૂ કરેલા પત્રકમાં” એ શબ્દો અને આંકડાને બદલે, “તેવા નમૂનામાં અને તેવી રીતે” એ શબ્દો મૂકવા;
- (ખ) પેટા-કલમ (૨)માં, “છ મહિના” એ શબ્દોને બદલે, “બે વર્ષ” એ શબ્દો મૂકવા;
- (ગ) પેટા-કલમ (૧૦)માં, “પેટા-કલમ (૩) હેઠળ” એ શબ્દો, કૌંસ અને આંકડા કમી કરવા;
- (ઘ) સ્પષ્ટીકરણમાં, ખંડ (૨)માં, પેટા-ખંડ (ખ) પછી, નીચેનો પેટા-ખંડ દાખલ કરવો:-

“(ખક) ખાસ આર્થિક ઝોનના વિકાસકાર અથવા ખાસ આર્થિક ઝોનના યુનિટને માલ અને સેવા અથવા તે બંનેના શૂન્ય-દરવાળા પુરવઠાના કિસ્સામાં, જ્યાં ચૂકવેલ વેરાનું રિફંડ, તેવા પુરવઠાના અથવા યથાપ્રસંગ, આવા પુરવઠામાં ઉપયોગમાં આવતી ઈનપુટ અથવા ઈનપુટ સેવાઓના સંબંધમાં ઉપલબ્ધ હોય, ત્યારે આવા પુરવઠાના સંબંધમાં, કલમ ૩૯ હેઠળ પત્રક રજૂ કરવા માટેની નિયત તારીખ;”.

સન ૨૦૧૭નો ગુજરાતનો ૨૫-મો.

૧૬. (૧) ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૧૪૬ હેઠળ, ગુજરાત સરકારે, કાઉન્સિલની ભલામણોને આધારે, બહાર પાડેલું, ગુજરાત સરકાર, નાણા વિભાગનું તારીખ: ૨૩મી જાન્યુઆરી, ૨૦૧૮નું જાહેરનામું ક્રમાંક: (જીએચએન-૬)જીએસટી-૨૦૧૮/એસ. ૧૪૬(૨)-૬ સુધારેલું ગણાશે અને પ્રથમ અનુસૂચિના કોલમ (૨)માં નિર્દિષ્ટ કરેલી રીતે, તે અનુસૂચિના કોલમ (૩)માં નિર્દિષ્ટ તારીખે અને તે તારીખથી પશ્ચાદવર્તી અસરથી સુધારેલું હોવાનું ગણાશે.

સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા અધિનિયમની કલમ ૧૪૬ હેઠળ બહાર પાડેલા જાહેરનામાનો પશ્ચાદવર્તી અસરથી સુધારો.

સન ૨૦૧૭ના ૦૧-૭-૨૦૧૭નો ગુજરાતના ૨૫-મા અધિનિયમની ૨૫-મો. કલમ ૪૮નો સુધારો.

(૨) પેટા-કલમ (૧)ના હેતુઓ માટે, ગુજરાત સરકારને, ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૧૪૬ હેઠળ સદરહુ જાહેરનામું સુધારવાની સત્તા હોય તેમ, તમામ મહત્વના

સમયે, પશ્ચાદવર્તી અસરથી, સદરહુ પેટા-કલમમાં ઉલ્લેખેલું જાહેરનામું પશ્ચાદવર્તી અસર સાથે સુધારવાની સત્તા રહેશે અને સત્તા હોવાનું ગણાશે.

સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા
અધિનિયમની
કલમ ૫૦ની
પેટા-કલમો (૧) અને
(૩), કલમ ૫૪ની
પેટા-કલમ (૧૨)
અને કલમ ૫૬
હેઠળ બહાર પાડેલા
જાહેરનામાનો પશ્ચાદવર્તી
અસરથી સુધારો.

સન ૨૦૧૭નો ૧૭. (૧) ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૫૦ની પેટા-કલમો (૧) અને (૩), કલમ (૫૪)ની પેટા-કલમ (૧૨) અને કલમ ૫૬ હેઠળ, ગુજરાત સરકારે કાઉન્સિલની ભલામણોને આધારે, બહાર પાડેલું, ગુજરાત સરકાર, નાણા વિભાગનું તારીખ: ૩૦મી જૂન, ૨૦૧૭નું જાહેરનામું ક્રમાંક: (જીએચએન-૩૦)જીએસટી-૨૦૧૭/એસ.૫૦, ૫૪ અને ૫૬ (૧)-૬ સુધારેલું ગણાશે અને બીજી અનુસૂચિના કોલમ (૨)માં નિર્દિષ્ટ કરેલી રીતે, તે અનુસૂચિના કોલમ (૩)માં નિર્દિષ્ટ કરેલી તારીખે અને તે તારીખથી પશ્ચાદવર્તી અસરથી સુધારેલું હોવાનું ગણાશે.

સન ૨૦૧૭નો
ગુજરાતનો
૨૫-મો.

(૨) પેટા-કલમ (૧)ના હેતુઓ માટે, ગુજરાત સરકારને, ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૫૦ની પેટા-કલમો (૧) અને (૩), કલમ ૫૪ની પેટા-કલમ (૧૨) અને કલમ ૫૬ હેઠળ, સદરહુ જાહેરનામું સુધારવાની સત્તા હોય તેમ, તમામ મહત્વના સમયે, પશ્ચાદવર્તી અસરથી, સદરહુ પેટા-કલમમાં ઉલ્લેખેલું જાહેરનામું પશ્ચાદવર્તી અસર સાથે સુધારવાની સત્તા રહેશે અને સત્તા હોવાનું ગણાશે.

અમુક કિસ્સામાં,
રાજ્ય વેરો લેવામાં
અથવા વસૂલ
કરવામાંથી પશ્ચાદવર્તી
અસરથી મુક્તિ

૧૮. (૧) ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૮ની પેટા-કલમ (૧) હેઠળ મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, કાઉન્સિલની ભલામણોને આધારે, બહાર પાડેલું, ગુજરાત સરકાર, નાણા વિભાગનું તારીખ: ૩૦મી જૂન, ૨૦૧૭નું જાહેરનામું ક્રમાંક: (જીએચએન-૩૧)જીએસટી-૨૦૧૭/એસ.૮(૧)(૧)-૬ના જાહેરનામામાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, માછલીના તેલ માટે હોય તે સિવાય, (૨૩૦૧ શીર્ષક હેઠળ આવતા) માછલીના ભોજનના ઉત્પાદન દરમિયાન ઉત્પન્ન થતાં અનિષ્ક્રમણીય બગાડના પુરવઠાના સંબંધમાં, સન ૨૦૧૭ની જુલાઈ મહિનાની ૧લી તારીખથી શરૂ થતી અને સન ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનાની ૩૦મી તારીખે પૂરી થતી (બંને દિવસો સહિત)ની મુદત દરમિયાન, કોઈપણ રાજ્ય વેરો લેવામાં અથવા વસૂલ કરવામાં આવશે નહિ.

સન ૨૦૧૭નો
ગુજરાતનો
૨૫-મો.

(૨) વસૂલ કરવામાં આવ્યા હોય પણ પેટા-કલમ (૧) તમામ મહત્વના સમયે અમલમાં હોત એવી રીતે વસૂલ કરવામાં આવ્યા ન હોય તેવા તમામ વેરાનું કોઈપણ રિફંડ કરવામાં આવશે નહિ.

સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫-મા
અધિનિયમની કલમ ૭ની
પેટા-કલમ (૨) હેઠળ
બહાર પાડેલા
જાહેરનામાની પશ્ચાદવર્તી
અસર.

૧૯. (૧) પેટા-કલમ (૨)ની જોગવાઈઓને અધીન રહીને, ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૭ની પેટા-કલમ (૨) હેઠળ મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકારે, કાઉન્સિલની ભલામણોને આધારે, બહાર પાડેલું, ગુજરાત સરકાર, નાણા વિભાગનું તારીખ: ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૮નું જાહેરનામું ક્રમાંક: (જીએચએન-૮૫)જીએસટી-૨૦૧૮/એસ.૭ (૨) (૩)-૬, સન ૨૦૧૭ના જુલાઈ મહિનાની ૧લી તારીખે અને તે તારીખથી તમામ હેતુઓ માટે, અમલમાં આવ્યું હોવાનું અને હંમેશા અમલમાં આવ્યું હોવાનું ગણવામાં આવશે.

સન ૨૦૧૭નો
ગુજરાતનો
૨૫-મો.

(૨) વસૂલ કરવામાં આવ્યા હોય પણ પેટા-કલમ (૧)માં ઉલ્લેખેલું જાહેરનામું તમામ મહત્વના સમયે અમલમાં હોત એવી રીતે વસૂલ કરવામાં આવ્યા ન હોય તેવા તમામ રાજ્ય વેરાનું કોઈપણ રિફંડ કરવામાં આવશે નહિ.

પ્રથમ અનુસૂચિ

[જુઓ કલમ ૧૬(૧)]

જાહેરનામા ક્રમાંક અને તારીખ	સુધારો	સુધારાના અમલની તારીખ
(૧)	(૨)	(૩)
(જીએચએન-૬)/જીએસટી-૨૦૧૮/એસ.૧૪૬(૨)૬ તારીખ: ૨૩મી જાન્યુઆરી, ૨૦૧૮	સદરહુ જાહેરનામામાં, પરિચ્છેદ ૧માં, “રિટર્ન (પત્રક) રજૂ કરવા અને સંકલિત વેરાની ગણતરી અને પતાવટ	૨૨-મી જૂન, ૨૦૧૭

જાહેરનામા ક્રમાંક અને તારીખ	સુધારો	સુધારાના અમલની તારીખ
(૧)	(૨)	(૩)
	<p>સરળ (સુવિધાજનક) બનાવવા માટે” એ શબ્દોને બદલે, નીચેનો મજકૂર મૂકવો:-</p> <p>“રિટર્ન (પત્રક) રજૂ કરવા અને સંકલિત વેરાની ગણતરી અને પતાવટ સરળ (સુવિધાજનક) બનાવવા માટે અને તારીખ: ૧૭મી ડિસેમ્બર, ૨૦૧૮ના જાહેરનામા ક્રમાંક. (જીએચએન-૧૨૧)જીએસટી-૨૦૧૮/એસ.૧૪૬(૩)ઠ- માં, અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ હેઠળ જોગવાઈ કરેલા તમામ કાર્યો કરવા માટે.”.</p>	

દ્વિતીય અનુસૂચિ

[જુઓ કલમ ૧૭(૧)]

જાહેરનામા ક્રમાંક અને તારીખ	સુધારો	સુધારાના અમલની તારીખ
(૧)	(૨)	(૩)
(જીએચએન-૩૦)જીએસટી-૨૦૧૭/એસ.૫૦, ૫૪ અને ૫૬(૧)-ઠ, તારીખ: ૩૦મી જૂન, ૨૦૧૭.	સદરહુ જાહેરનામામાં, કોષ્ટકમાં, અનુક્રમાંક ૨ સામેના કોલમ (૩)માં, “૨૪” એ આંકડાને બદલે, “૧૮” એ આંકડા મૂકવા.	૧લી જુલાઈ, ૨૦૧૭

